



AD-2767

Third Year B. Com. (Sem. VI) Examination
March / April - 2015
Advanced Accounting & Auditing : Paper-VII
(CE - 620 A-1)

Time : 2 Hours]

[Total Marks : 50

સૂચના :

(1)

| | |
|--|----------------------|
| નીચે દર્શાવેલ નિશાનીવાળી વિગતો ઉત્તરવહી પર અવશ્ય લખવી. Fillup strictly the details of signs on your answer book. | Seat No. : |
| Name of the Examination : | <input type="text"/> |
| <input type="text" value="T. Y. B. COM. (SEM. 6)"/> | <input type="text"/> |
| Name of the Subject : | <input type="text"/> |
| <input type="text" value="ADVANCED ACCOUNTING & AUDITING - 7"/> | <input type="text"/> |
| Subject Code No. : <input type="text" value="2"/> <input type="text" value="7"/> <input type="text" value="6"/> <input type="text" value="7"/> | <input type="text"/> |
| Section No. (1, 2,.....) : <input type="text" value="Nil"/> | <input type="text"/> |
| | Student's Signature |

(2) જમણી બાજુના અંક પ્રશ્નના પૂરા ગુણ દર્શાવે છે.

(3) દરેક પ્રશ્નના મુદ્દાસર અને સ્પષ્ટ જવાબની અપેક્ષા છે.

1 ટૂંકમાં ઉત્તર આપો :

10

(1) કંપની ઓડિટરની ગેરલાયકાતો જણાવો.

(2) ઓડિટરના અહેવાલનું શેહોલ્ડરો માટે મહત્ત્વ સમજાવો.

(3) ઓડિટ અને અન્વેષણ વચ્ચેના કોઈ પણ ચાર તફાવત જણાવો.

(4) બેંકના ઓડિટરની લાક્ષણિકતાઓ જણાવો.

(5) કઈ વ્યક્તિઓએ કલમ 44 એબી હેઠળ પોતાના હિસાબો ઓડિટ કરાવવાની જરૂર નથી ?

2 (અ) 1956ના કંપની ધારાની જોગવાઈ મુજબ ઓડિટરના હકો અને ફરજો સમજાવો.

7

(બ) કંપની ઓડિટરની ફોજદારી જવાબદારીની ચર્ચા કરો.

6

અથવા

- 2 (અ) ઓડિટરનો અહેવાલ અને ઓડિટરનું પ્રમાણપત્ર વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. 7
 (બ) ત્રાહિત પક્ષ પ્રત્યે ઓડિટરની જવાબદારીની ચર્ચા કરો. 6
- 3 (અ) વહેંચણીપાત્ર નફો એટલે શું ? મૂડી નફાનો ઉપયોગ ડિવિડન્ડ ચૂકવવા માટે થઈ શકે ? 7
 (બ) ચાલુ ધંધો ખરીદવા માંગનાર વતી અન્વેષણ તમે કેવી રીતે કરશો ? 6

અથવા

- 3 (અ) ઓડિટ કાર્યક્રમનું મહત્ત્વ સમજાવો. એક કોમર્સ કોલેજનાં હિસાબોને ઓડિટ કરવા અંગેનો ઓડિટ કાર્યક્રમ તૈયાર કરો. 7
 (બ) પડતરના ઓડિટ અંગેની કાનૂની જોગવાઈઓ જણાવો. 6
- 4 (અ) કરવેરાનું ઓડિટ એટલે શું ? તેના ઉદ્દેશો જણાવો. કરવેરા ઓડિટને લગતી કાયદાકીય જોગવાઈઓ સમજાવો. 5
 (બ) બોનસ શેર બહાર પાડવા અંગે 'સેબી'ના માર્ગદર્શક સૂચનો જણાવો. 5
 (ક) અન્વેષણ કરતી વખતે કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ ? 4

અથવા

- 4 ટૂંકનોંધ લખો : (ગમે તે ત્રણ) 14
- (1) સ્વેટ ઈક્વિટી શેર બહાર પાડવા અંગે કંપની ધારો, 1956ની જોગવાઈઓ
 (2) કાર્યક્ષમતા ઓડિટ
 (3) ઓડિટરનો વિશેષ હક
 (4) ઈડીપીના હિસાબો અંગેના અંકુશો
 (5) સામાન્ય વીમા કંપનીના હિસાબો અને ઓડિટને લગતા કાયદા અને નિયમો

ENGLISH VERSION

- Instructions :** (1) As per the instruction No. 1 of Page No. 1.
- (2) Figures to the right indicate full marks of the question.
- (3) Clear and to the point answer to each question is expected.

1 Answer in brief : **10**

- (1) State the disqualifications of a company auditor.
- (2) Explain the importance of auditor's report to the shareholders.
- (3) State any four differences between Audit and Investigation.
- (4) State the characteristics of Bank audit.
- (5) Who are the persons not required to get their accounts audited under Sec. 44 AB ?

2 (a) Explain the rights and duties of an auditor under the provisions of Companies Act, 1956. **7**

(b) Discuss the criminal liability of a company auditor. **6**

OR

2 (a) Distinguish between Auditor's report and Auditor's certificate. **7**

(b) Discuss the auditor's liability towards third parties. **6**

- 3 (a) What is Divisible Profit ? Can capital profit be utilized for the payment of dividend ? 7
- (b) How will you investigate on behalf of an intending purchaser of a running business ? 6

OR

- 3 (a) Explain the importance of Audit Programme. Prepare an Audit Programme to audit the accounts of a Commerce College. 7
- (b) State the legal provisions relating to cost audit. 6
- 4 (a) What is Tax audit ? What are its objectives ? Explain the legal provisions relating to tax audit. 5
- (b) State the guidelines of SEBI on issue of Bonus shares. 5
- (c) What are the points to be considered while conducting an investigation ? 4

OR

- 4 Write short notes : (any **three**) 14
- (1) Provisions of Companies Act, 1956 regarding Sweat Equity Shares.
- (2) Efficiency audit.
- (3) Auditor's lien.
- (4) EDP controls.
- (5) Provisions of law and regulations regarding accounts and audit of general insurance companies.